

ડૉ. પી. સી. ચાવડા

શારિરીક શિક્ષણ વિમાગ

મનુન્સ શેઠ. આર. એ. એ. સી

## લોકશાહી અને સંસ્કૃતિ

**પ્રાસ્તાવિક:-** લોકશાહી એટલે લોકોને સાર્વભૌમુકત રીતે ઉન્મુક્ત જીવન જીવવાની શૈલી.જેમાં વિફરવા અને વિચરવાની બે પાંખોથી લોકો સ્વતંત્ર ઉડાન ભરી શકેછે.વસુંધરા પર માનવ વસવાટની સાથેજ લોકશાહીનું સિંચન થયેલું કહેવાય છે.લોકશાહીનો સાદો અર્થ કરીએતો લોક + શાહી. શાહી એટલે ભવ્ય.જેમાં બાદશાહ,પાદશાહ અને શહેનશાહ શાહી રીતે જીવતાતા.એવી શાહી રીતે જીવવાની શૈલી એટલે લોકશાહી.લોકશાહીમાં વાણી,વિચાર લેખન,કળા,સાહિત્ય કે સંગીતને કોઈ બંધનરૂપી સિમાડા હોતા નથી.લોકશાહીનો વિચારજ લોકીની સર્વ પ્રકારની અભિવ્યક્તિને ઉજાગર કરવાનો છે.લોકશાહીના પગરણની સાથેજ લોકશાહીની ધરોહરને મજબૂત બનાવવા સંસ્કૃતિરૂપી વેલ લોકશાહીને ચોગરદમ વીટળાઈને લોકશાહીને વધુ વિકસિત બનાવે છે.તેથીજ તો કોઈ સંસ્કૃતિને લોકશાહીની પરબ કહેછે. કોઈ તેને લોકશાહીની દીવાદાંડી કહે છે.તો કોઈ સંસ્કૃતિને લોકશાહીનું રાષ્ટ્રીય ધરેણું કહે છે.આમ સંસ્કૃતિના સુભગ સમન્વયથી લોકશાહીની વિરાસત સોળેકળાએ દીપી ઉઠે છે.

**પૌરાણિક સમય:-** પૌરાણિક સમયમાં ભારતની ભાષા સંસ્કૃત હતી.રાણી શહુંતલા અને રાજી દુષ્યંતના પુત્ર ‘મરત’ ના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું.આવી સંસ્કૃતિ અને લોકશાહીની ઉચ્ચ કોટિની વિમાવના એ ભારત ભૂમિને આભારેછી.મહર્ષિ વાખીકી અને મહર્ષિ વ્યાસે રામાયણ અને મહાભારતમાં ભારતમાતાના ચર્તુભૂજ સ્વરૂપનાં દર્શન કરાવવા પાછળનો રાષ્ટ્રીય એકતાનો ઋષિનો આદર્શ એ આપણી પ્રાચીન યુગથી પ્રસ્થાપિત રાષ્ટ્રીય એકતાનું ઘોતક છે.તેઓએ બે મહાકાવ્યો દ્વારા ભારતીય સંસ્કૃતિની દિવ્ય અનુભૂતિનાં દર્શન કરાવ્યાં છે.આમ પૌરાણિક સમયથી જ ભારતમાં લોકશાહી અને સંસ્કૃતિનો સુરથ આપણને ઘબકતો જોવા મળેછે. ભારતવર્ષમાં રામરાજ્યની વિમાવનાએ લોકશાહી અને સંસ્કૃતિને સર્વીચ્ચ શિખરે બિરાજમાન કરી છે.રાજશાહી છતાં પ્રજાશાહી! પ્રજામત દ્વારા જ રાજ રાજ સિંહાસન પર આડુઠ થાયછે.એટલે કે રાજ એ પ્રજાનો પ્રતિનિધિ માત્ર છે.કેવી

હો. આ લોકશાસ્થીની ઉદાત ભાવના! આમ રાજાનું શાસન એ સહૈવ પજાભિમુખ રહેતું હતું. ભારતીય સંસ્કૃતિની મૂળ ભાવના એ વસુધૈવ કુટુંબકમ્ની છ. એટલે કે આપું વિશ્વ મારું કુટુંબ છ. આ વિભાવના દ્વારાજ લોકશાસ્થીનો નજરો (તિખારો) આપણાને જળહળતો જોવા મળેછ. પ્રાચીન સમયમાં ઋષિમુનીઓએ સંસ્કૃતિને ધર્મની સાથે સાંકળીને પજા અને પ્રકૃતિનાં તત્ત્વોને નિભારવાનો પ્રયત્ન કર્યો છ. જગદૈવ, પવનદૈવ, અનિનદૈવ, સૂરજદાદા, ચાંદમામા અને નદીમાતા જેવાં વગેરે પ્રકૃતિનાં તત્ત્વોને માનવજીવન સાથે વળ્ણીને સંસ્કૃતિની ભાવનાને ઉદાત બનાવીને લોકોનો સાંસ્કૃતિક વારસો વધુ ભવ્ય બનાવ્યોછ. ‘જીવો અને જીવવા દો’ ની ઉત્કષ્ટ ભાવનાએ લોકશાસ્થીનું તાત્વદર્શિક ચિંતન છ. જેના લીધે લોકશાસ્થીને વધુ પ્રજ્જવલિત કરવા માટે ઋષિમુનીઓએ ઉપનિષદ્ધીમાં પણ કહ્યુછે કે આ નો ભદ્રો કઠવો યન્તુ વિશ્વતઃ (અમને દરેક દિશાએથી શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાવો) આવા ઋષિમુનીઓના ચિંતન અને મનનથી ‘ત્યેન ત્યક્તેન ભૂજ્યથા’ (ત્યાગીને ભોગવ) એવા શુભ આશયનો જન્મ થયો અને તેમાંથી લોકોની રહેણી કરણીમાં કાનિકારી પરિવર્તન આવ્યું ને લોકશાસ્થીના પોષકતત્ત્વને બળ મળ્યું. નદી તટ અને પ્રકૃતિની ગોદમાં રહેતાં દિન-પ્રતિદિન માનવ સંસ્કૃતિ અને સમ્યતાનો વધુ ને વધુ વિકાસ થતો ગયો અને તેમાંથી અતિ મૂલ્યવાન આર્યુવેદનો પ્રાર્દ્દ્ધમાવ થયો. જેની અમૂલ્ય ઔષધિઓએ લોકોને ફજરો વર્ષોનું જીવન પ્રદાન કર્યુછે. આમ લોકોનું જીવન નિરામય રહેતાં લોકો હુન્નર, કળા, સંગીત, દ્વન્દ્વ, પ્રતિનય રમતો, તરણ, શિકાર વગેરે બાબતોમાં ઘણી નિપૂણતા ધરાવતા હતા. આમ પૌરાણિક સમયથી જ ભારતીય સંસ્કૃતિના ભાતીગળ ચંદ્રવાથી લોકશાસ્થીનો ઝર્ઝો પ્રકાશપૂર્જની જેમ ઝર્ઝુંબીરહ્યો છ. તેથી સાચેજ કહેવાયું છે કે પ્રકૃતિના પ્રાંગણમાં સંસ્કૃતિનું ઝરણું સદાય અવિરત વહેતું હોય છ.

**મધ્યયુગ:-** મધ્યયુગમાં ઘરુાખરા રાજાઓએ લોકશાસ્થીને મુરકેટાટ બાંધી દીધી હતી એમ કહી શકાય. કારણ કે રાજાઓ સત્તાભિમુખ બની સત્તાના નશામાં આગોટતા હતા અને પજા પર કાળો કેર વર્તોવતા હતા. રાજાઓ મોજશોખ, ભોગવિલાસ અને જૈયાશીમાં જીવન વિતાવતા હતા. લોકો રાજશાસ્થીથી >ાંધીમામ પોકારી ગયા હતા. રાજાએ પજાકલ્યાણનાં કાર્યો કરવાને બદલે માત્ર રાજ્યવિસ્તાર માટે યુદ્ધો ચાલું રાખ્યાં તેથી સંસ્કૃતિનું પણ હનન થતું ગયું. મધ્યયુગમાં રજવાડાં અને સલ્તનતોએ લોકશાસ્થી અને સંસ્કૃતિની પાંખો કાપી નાખી હતી. નાચ, ગાન અને સંગીત માત્ર દિવાનખાનાં તેમજ રાજ મહેલાતોમાં મુજરાનું પ્રતિક બન્યાં હતાં. લોકો વહેમ, અંધશ્રદ્ધા અને કુરિવાજો માં અથડાતા હતાં ભારતમાં આ સમયમાં ઘણી

વિદેશી પ્રજાઓ આવી જેવી કે શક, હુગ, ડચ, ફિરંગી અને અંગ્રેજોએ ભારતીય પ્રજાને ગુલામીની અવસ્થામાં રાખી અને પ્રજાનું શોષણ કર્યું. લોકો લૂંટ, બર્બરતા, શોષણથી તંત્ર આવી ગયાં હતાં. પ્રજામત્ર પ્રબળ બનતાં અને દેશદાનની ભાવના લોકોના દિલમાં ઉમ્ભરતાં લોકશાહીનો બુંગીયો દરેકના દિલમાં ગાજવા માંડ્યો. પ્રજાવત્સલ લોકનેતાઓ અને પ્રજા જીવાળથી લોકશાહીની લાલીમા ભારતના દરેક પાંતમાં પ્રસરી ગઈ.

**આધુનિક યુગ:-** મા ભારતી સ્વતંત્ર થતાં લોકશાહીની લહેરની કાશિમરથી કન્યાકુમારી અને ગુજરાતથી પશ્ચિમબંગાળ સુધી લહેરાવવા માંડી અને ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહીનું રાષ્ટ્ર બન્યું. ભારતની લોકશાહીનું તંત્ર લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું તંત્ર બન્યું. જેમાં છલ્પીસ રાજ્યોની ભાતીગળ સંસ્કૃતિની ‘વિવિધતામાં એકતા’, ‘અનેકતામાં એક્ક્રૂપતા’ જેવી લોકશાહીનું કંકણ સારાય વિશ્વમાં ખનકવા માંડ્યું. ‘સેવા પરમો ધર્મ’ ‘અંહિસા પરમો ધર્મ’ ‘સર્વ ધર્મ સમભાવ’ નાં મૂલ્યો તેમજ ભારતીય લોકશાહીનો મુદ્રાલેખ ‘સત્યમેવ જ્યતે’ એ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય લોકશાહી નાં તત્વોને નિષાળવા વિશ્વને મજબૂર બનાવ્યું. આધુનિક સમયમાં ભારતની લોકશાહી એક વટવૃક્ષ સમાન બનીને ભારતમાં વસેલી લગભગ 3000 જાતિઓ અને વિશ્વના તમામ ધર્મોનો સેતુ રચીને એક અજોડ લોકશાહી અને અદ્ધૃતીય સંસ્કૃતિની અમીટ છાપ વિશ્વ માનસમાં ઉભી કરીછે. આ અરસામાં ગાંધીજીનો વાલીપણાનો (દ્રસ્ત્રીશીપ) સિદ્ધાંત અને વિનોભાભાવેની ભૂદાન પ્રવૃત્તિએ લોકશાહીમાં નવું જોમ પુરુષ પાડ્યું. લોકો સ્વૈચ્છીક ભૂદાન થજ અને શ્રમ સેવાયજ્ઞમાં જોડાયાં. લોકશાહીથી લોકોનાં વાળી, વિચાર અને વ્યક્તિ સ્વાતંત્ર્ય સ્વતંત્ર બનતાં લાકોએ તેમજ ભારતે અનેક ક્ષેત્રોએ સફળતાનાં શિખરો સર કર્યાં. નૃત્ય, સંગીત, લેખન, કળા, હુન્નર વગેરેમાં ભારતીય અસ્મિતાનું પ્રતિબિંબ ઝળુંબવા લાગ્યું અને સંસ્કૃતિએ માણસને વ્યક્તિ વિકાસવાદી ન રહેતાં સમૂહ વિકાસવાદી બનાવ્યો.

**ઉપસંહાર:-** ભારતીય સંસ્કૃતિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પાયા પર રચાયેલી છે. આ સંસ્કૃતિએ ભગવાન શિવ દ્વારા લોકોને દિવસમાં કેટલી વાર ખાવું અને ન્હાવુંનો ભગવદ સંદેશ આપેલ છે. હનુમાનજી દ્વારા હવામાં ઉઠાન અને ભગવાન રામ દ્વારા સમૃદ્ધ પર પ્રથમ સેતું બાંધવાનું શ્રેય ભારતીય સંસ્કૃતિને આભારી છે. ભારતીય સંસ્કૃતિએ ચાર વેદ, અઠાર પુરાણ, મટશાસ્કા નો જ્ઞાનનો ખજાનો વિશ્વ ચરણે ભેટ ધર્યો છે. શૂન્યની

શોધ અને ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર એટલે કે ચક્રની શોધ એ ભારતભૂમીને આભારી છ.વર્તમાન સમયમાં પંડિત જવાહરલાલ નહેરુએ પંચશીલના સિધ્યાંત દ્વારા વિશ્વને લોકશાહીની આગવી સ્થૂળનો પરિગ્રય કરાવ્યો છ.આમ સદૈવ ભારતીય સંસ્કૃતિ અને લોકશાહી કલ્યાણ અને માનવતાની ભાવનાને વરેલી છ. તેથીજ ઉચ્ચ આદર્શ અને કલ્યાણના પાયા પર રચાયેલી લોકશાહી અને સંસ્કૃતિની ઇમારત આજે પણ અડીખમ ઉભી છ.આમ કહી શકાય કે લોકશાહી એ લોકોની મૌલીકતાની અભિવ્યક્તિ છ.જ્યારે સંસ્કૃતિ ઓ લોકોની રહેણી કરાગીનું સરવૈચું છ.